

જુલાઈ 25, 2018

ડાઉનટાઉન બ્રામ્પટનમાં અલગોમાનું વિસ્તરણ પરિવર્તનમાં ઉમેરો કરે છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો – બ્રામ્પટનના ડાઉનટાઉનમાં રોમાંચક વિકાસો આજ સુધી ચાલુ રહ્યા કારણ કે અલગોમા (Algoma) યુનિવર્સિટીએ નવી સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ ઇકોનોમિક્સની જાહેરાત કરી. આ યુનિવર્સિટીના બ્રામ્પટન કેમ્પસમાં આ વિસ્તારેલા કાર્યક્રમ માટે પ્રવેશ આગામી સપ્ટેમ્બરમાં શરૂ થશે. બ્રામ્પટન અને GTA માં વિદ્યાર્થીઓ પાસે હવે ચાર-વર્ષની સ્નાતક પદવીની (ગ્રેજ્યુએટ ડીગ્રીની) બે નવી પસંદગી, બિઝનેસ કે ફાઈનાન્સ અને ઇકોનોમિક્સમાં રહેશે, બંને અભ્યાસક્રમો ડાઉનટાઉન બ્રામ્પટનના હાર્ટસમા વિસ્તારમાં ચલાવવામાં આવશે.

આ રોમાંચક સમાચાર બ્રામ્પટનના પાયાના નવા વિકાસો અને પરિવર્તનના ગણગણાટમાં ઉમેરો કરે છે, ખાસ કરીને કારણ કે તે બ્રામ્પટન અને GTA નાં વિદ્યાર્થીઓ માટે નવા સ્નાતકોત્તર (પોસ્ટ-ગ્રેજ્યુએટ) વિકલ્પોને સંબંધિત છે. નવા રાયરસન યુનિવર્સિટી કેમ્પસ, અને ડાઉનટાઉન રિઈમેજીન્ડ પ્રોજેક્ટ માટેનું કામ પાનખરમાં શરૂ થવાની યોજનાઓ ચાલી રહી છે ત્યારે, બ્રામ્પટનનું ડાઉનટાઉન શીખવા, કામ કરવા અને રમતો રમવા માટે એક નિર્ધારિત સ્થળ બની રહ્યું છે.

અલગોમા યુનિવર્સિટીના બિઝનેસ અભ્યાસક્રમનું આગામી પ્રકરણ યુનિવર્સિટીની કટિબદ્ધતા પર ઊભું થશે જેથી સ્પર્ધાત્મક મૂલ્યવાન, ગુણવત્તા શૈક્ષણિક અભ્યાસક્રમો પૂરા પાડી શકાય જે સ્થાનિક ધંધાકીય સમુદાય અને તદઉપરાંત જરૂરિયાતોને સહાયક બનવાની સાથે સાથે વિદ્યાર્થીઓને લાંબા-ગાળાની કારકિર્દી સફળતા માટે તૈયાર કરે.

અલગોમા યુનિવર્સિટીએ ડાઉનટાઉન બ્રામ્પટનમાં બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કાર્યક્રમ વર્ષ 2010 ની પાનખર ઋતુમાં, માત્ર 40 થી સહેજ ઓછાં વિદ્યાર્થીઓ સાથે શરૂ કર્યો હતો. શરૂઆતના કાર્યક્રમનું મોડેલ પોતાની વ્યવસાયિક કારકિર્દીઓમાં આગળ વધવાના હેતુસર ઉપસ્નાતક (અન્ડર-ગ્રેજ્યુએટ) બિઝનેસ ડીગ્રી પૂરી કરવા ઇચ્છતા કોલેજના ડિપ્લોમા વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો. પ્રવેશમાં દર વર્ષે 100 કરતા વધારે વિદ્યાર્થીઓનો વધારો થયો, અને યુનિવર્સિટી આગામી ત્રણ વર્ષોમાં 500 કરતા વધારે વિદ્યાર્થીઓ સુધી વિસ્તરણ કરવાની યોજનાઓ ધરાવે છે.

ઝડપી હકીકતો

- લગભગ 200 વિદ્યાર્થીઓએ અલગોમા યુનિવર્સિટીના બ્રામ્પટન કેમ્પસમાં પોતાની ડીગ્રી જરૂરિયાતો પૂરી કરી છે
- અલગોમા યુનિવર્સિટીના બ્રામ્પટન કેમ્પસના આશરે 70 ટકા જેટલા વિદ્યાર્થીઓ બ્રામ્પટન કે સંલગ્ન સમુદાયોના છે. બાકીના વિદ્યાર્થીઓ અન્ય GTHA સમુદાયો તેમજ ચીન, ભારત અને અન્ય દેશોના છે.
- [રાયરસન યુનિવર્સિટીનું નવું ડાઉનટાઉન કેમ્પસ 2022](#) ની પાનખરમાં વર્ગો માટે ખુલે તેવું આયોજન હાલમાં છે, જે સાર્થબર સાયન્સ અને બિઝનેસની સાથે ઉપસ્નાતક કાર્યક્રમોમાં પ્રયોગાત્મક શિક્ષણ આપે છે.
- આ શહેર એક [બિઝનેસ ઇન્ક્યુબેટર](#) અને સહ-સંચાલિત વિસ્તાર શરૂ કરવા ખાલી જગ્યા ડાઉનટાઉનમાં તૈયાર કરી રહ્યું છે, જેમાં રાયરસન યુનિવર્સિટી પોતાની નવીન શોધ અને સંપ્રાપ્તિ વડે પોતાના વ્યાપક અનુભવમાંથી પસંદ કરેલા શ્રેષ્ઠ વ્યવહારો વહેંચશે.
- સીટી ઓફ બ્રામ્પટન અને રીજીયન ઓફ પીલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને બ્યુટિફિકેશન પ્રોજેક્ટ [ડાઉનટાઉન રિઈમેજીન્ડ](#) શરૂ કરવાની તૈયારીમાં છે, જે ઐતિહાસિક ફોર (ચાર) કોર્નર્સની આસપાસ સૌંદર્યથી ભરપૂર સ્ટ્રીટસ્કેપ સાથે જાહેર વિસ્તારને કંપાયમાન બનાવશે.

અવતરણો (ક્વોટ્સ):

“મને એ સાંભળીને રોમાંચ થાય છે કે અલગોમા યુનિવર્સિટી ડાઉનટાઉન બ્રામ્પટનમાં નવી બિઝનેસ એન્ડ ઈકોનોમિક્સ સ્કૂલ સમાવવા વિસ્તરણ કરી રહ્યું છે. આ નવા કાર્યક્રમો આપણાં શહેરમાં વધારે ગુણવત્તાસભર શિક્ષણ આપવાના આપણાં લક્ષ્ય પર થશે અને બ્રામ્પટનના વિદ્યાર્થીઓ અને ધંધાઓ માટે પ્રગતિ કરવા વધારે તકો ઊભી થશે.”

- *બ્રામ્પટન મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)*

“અલગોમા યુનિવર્સિટીને બ્રામ્પટનમાં આપણાં માધ્યમિક-પર્યંત પહોંચ વધારવાના લાંબા-સમયના પ્રયત્નો માટે રોમાંચક આગામી તબક્કા તરીકે સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ ઈકોનોમિક્સ શરૂ કરવાનું ગૌરવ છે. નવી સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ ઈકોનોમિક્સ બ્રામ્પટનના ધંધાકીય સમુદાયની જરૂરિયાતોને સહાયતા કરવા આપણાં વિદ્યાર્થીઓ સારી રીતે તૈયાર રહે તે ખાતરી કરાવવાની સાથે સાથે આપણાં કાર્યક્રમોની ગુણવત્તા સુધારવા પાછળની આપણી સતત કટિબદ્ધતા દર્શાવે છે. અમે ડાઉનટાઉનના પાયાના વિકાસ માટે સીટી ઓફ બ્રામ્પટનના દૂરદેશીપણાંથી રોમાંચિત છીએ અને સમુદાયની વધતી જતી જરૂરિયાતોને ટેકો આપવામાં સહાયક રીતે માધ્યમિક-પર્યંત ક્ષેત્રમાં મંત્રાલય અને આપણાં ભાગીદારો સાથે કામ કરવા આશાવાદી છીએ.”

- *અસિમા વેઝિના (Asima Vezina), પ્રેસિડન્ટ અને વાઈસ-ચાન્સેલર, અલગોમા યુનિવર્સિટી*

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો યાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.